

Dr. Babasaheb Ambedkar Open University
Term End Examination January -2026

Course	: B.Com.	Date	: 22/02/2026
Subject Code	: ECO-04	Time	: 11:30am to 01:45pm
Subject Name	: નામા પદ્ધતિ-2	Duration	: 02.15 Hours
		Max. Marks	: 70

પ્રશ્ન-1 કંપનીનો અર્થ આપી કંપની અને ભાગીદારી પેઢી વચ્ચેનો તફાવત સમજાવો. 14

અથવા

વાઉચિંગનો અર્થ આપી તેના હેતુઓ અને મહત્વ જણાવો.

પ્રશ્ન-2 SSKની કંપનીની નીચે આપેલી માહિતીની મદદથી તેના ચોપડામાં જરૂરી ખાતાં બનાવો. તેઓ પડતરમાં 25 % નફો ઉમેરીને માલ વેચે છે. સ્ટોક અને દેવાદારોની પદ્ધતિનો ઉપયોગ કરો. 14

દુકાનમાં માલનો સ્ટોક

તા. 1-4-95ના રોજ	15,000
તા. 31-3-96ના રોજ	12,500
ભાડે ખરીદના ગ્રાહકો પાસે માલ (તા. 1-4-95)	18,000
દુકાનમાં સ્ટોક માટે ખરીદી	32,300
1995-96ના વર્ષ દરમિયાન ભાડે ખરીદથી વેચેલ માલ	43,500
મળેલા હપતા	30,000
ચઢેલા હપતા	
તા. 1-4-95ના રોજ	1000
તા. 31-3-96ના રોજ	1500

અથવા

નાણાકીય પત્રકોના ઉપયોગો અને મર્યાદાઓ જણાવો.

પ્રશ્ન-3 31 ડિસેમ્બર, 1995 ના રોજ પૂરા થતાં વર્ષ માટે દિલ્હી શાખાને લગતી નીચે આપેલી માહિતીના આધારે મુખ્ય ઓફિસના ચોપડામાં શાખા ખાતું તૈયાર કરો. 14

વિગત	રૂ.	વિગત	રૂ.
1-1-95ના રોજ શાખા પાસે માલ	15,000	શાખાને મોકલેલ ચેક	
1-1-95ના રોજ શાખાના દેવાદારો	30,000	પગાર માટે	9,000
1-1-95 રોજ શાખાની પેટા રોકડ	300	ભાડું અને કર માટે	1,500
શાખાને મોકલેલ માલ	2,52,000	પેટા રોકડ માટે	1,100
રોકડ વેચાણ	60,000	શાખાએ પરત કરેલ માલ	2,000
દેવાદારો પાસેથી મળ્યા	2,10,000	31-12-95ના રોજ શાખા પાસે	
ઉધાર વેચાણ	2,28,000	માલનો સ્ટોક	25,000
		31-12-95ના રોજ શાખાની પેટા	
		રોકડ	200
		31-12-95ના રોજ શાખાના	
		દેવાદારો	48,000

અથવા

તા. 31 જાન્યુઆરી, 2021ના રોજ લોકનાથના મકાન અને વખારમાં આગ લાગી હતી. તેના હિસાબી

ચોપડાઓ અને અન્ય નોંધો ઉપરથી નીચેની માહિતી પ્રાપ્ત થઈ હતી.

વિગત	2018 (રૂ.)	2019 (રૂ.)	2020 (રૂ.)	2021 (રૂ.)
શરૂઆતનો સ્ટોક	13,545	16,200	18,000	18,450
ખરીદી બાદ પરત	37,450	40,000	40,500	3,000
વેચાણ બાદ પરત	60,000	66,000	70,000	6,000
મજૂરી	8,700	9,500	10,450	1,000
આખર સ્ટોક	16,200	18,000	18,450	---

સ્ટોકની કિંમત હમેશા પડતર કિંમતથી 10% નીચી કિંમતે આંકવામાં આવે છે. આગથી નાશ પામેલા માલની કિંમત ગણો.

પ્રશ્ન-4 નફા-નુકસાન ખાતાનો નમૂનો અને પાકા સરવૈયાનો નમૂનો કાલ્પનિક વિગતે દર્શાવો.

14

અથવા

ABC લિમિટેડ પડતર કિંમત પર 50% નફો ચઢાવીને ભાડે ખરીદ પદ્ધતિ અનુસાર માલનું વેચાણ કરે છે 31-12-18 ના રોજ પૂરા થતા વર્ષનું ભાડે ખરીદ વેપાર ખાતું તૈયાર કરો.

ભાડે ખરીદનો સ્ટોક શરૂઆતનો	18,000
લેણા હપતા ગ્રાહકો દ્વારા ચુકવણી (શરૂઆતના)	10,000
વર્ષ દરમિયાન ભાડે ખરીદ પદ્ધતિથી વેચેલ માલ (ભાડે ખરીદ કિંમત)	1,74,000
ગ્રાહકો પાસેથી મળેલ રોકડ	1,20,000
પુનઃપ્રાપ્ત કરેલ માલની બજારકિંમત (નહી ચુકાવેલ હપતા રૂ.60000)	3,000
ભાડે ખરીદનો સ્ટોક (આખરનો)	60,000
લેણા હપતા (ગ્રાહકો દ્વારા ચુકવણી) (આખરના)	16,000
ખર્ચાઓ	19,000

પ્રશ્ન-5 ટ્રેકનોંધ લખો. (કોઈ પણ બે)

14

1. આંતરિક ઓડિટ અને કાયદેસરના ઓડિટ વચ્ચેનો તફાવત
2. ગુણોત્તર વિશ્લેષણના હેતુઓ અને વર્ગીકરણ લખો.
3. રોકડ પ્રવાહના પત્રકના ઉપયોગો લખો
4. શેરમૂડીના પ્રકારો
5. પાઘડીના મૂલ્યાંકનની પદ્ધતિઓ
6. શાખાના પ્રકારો
